



# મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ

## વીજ સલામતી માટે આટલું જરૂરથી કરો...



ઇલેક્ટ્રિક શોકથી બચવા ઘરમાં યોગ્ય રીતે અર્થિંગ કરો. અર્થ વાયરને ન્યુટ્રલ વાયર સાથે કે પાણીની પાઇપ સાથે જોડવા નહીં પરંતુ તેને અલગ જોડાણ આપવું.

પિન વગર પ્લગમાં વાયર તેમજ ઓવરલોડીંગ ન થાય તે હેતુસર એક પ્લગમાં વધુ સાધનો જોડવા નહીં તથા ઘરના વાયરિંગ સાથે **ELCB** અચૂક લગાવશો.




ભીના હાથથી વીજળીની સ્વિચ ચાલુ બંધ ન કરો અને સ્વિચ તેમજ પ્લગની ઊંચાઈ એવી રાખો કે જેથી નાના બાળકોની પહોંચથી દૂર રહે જેથી અકસ્માતની સંભાવના ન રહે.

કપડાં સુકવવા માટે વીજળીના થાંભલાનો ઉપયોગ કરવો નહીં. વીજ લાઇનના તૂટેલા તારને અડકવું નહીં. લાકડી કે વિદ્યુત અવાહક હોય એવી વસ્તુઓથી તેને અળગો કરવો પરંતુ ખુલ્લા હાથે અડકશો નહીં કે ખેંચવાનો પ્રયત્ન કરવો નહીં કેમકે તે જીવલેણ બની શકે છે.



વીજ લાઇનની નીચે/ નજીક કોઈ પ્રકારનું બાંધકામ કરવું નહીં કે પ્રાણીઓને બાંધવા નહીં. ઘરની બાલ્કની કે અગાશી વીજળીની લાઇનથી સલામત અંતરે રાખો. ઘરની બારીમાંથી અથવા ગેલેરીમાંથી કોઈ પણ જાતનો કચરો, પાણી, મેટાલીક ચાર્ન, તાર, વાયર કે લોખંડનો ભંગાર વિગેરે વીજ લાઇન પર ફેંકશો નહીં. તેમ કરવાથી ઇલેક્ટ્રિક કરંટ (શોક) લાગવાનો ભય રહે છે.

કોઈક કારણસર અન્ય અઘટિત ઘટના બને તો તાત્કાલિક અમારા ચોવીસ કલાક કાર્યરત કોલ સેન્ટર નંબર ૧૯૧૨૪ અથવા ૧૮૦૦૨૩૩૨૬૭૦ તેમજ વોટ્સએપ નં. ૯૯૨૫૨ ૧૮૦૦૨ પર જાણ કરો જેથી જરૂર પડ્યે તુરંત જ વિજપ્રવાહ બંધ કરી આગળની કાર્યવાહી કરી શકાય. આમ વીજ કંપનીને સહકાર આપીને વીજ સલામતીના ભાગીદાર બનો.



# મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ

## વીજ સલામતી માટે આટલું જરૂરથી કરો...





વીજ લાઇનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટર કે તેની ફેન્સિંગ ને અડીને વાહનો ઉભા રાખવા નહિં કે પાર્ક કરવા નહિં તેમજ વધુ ઉંચાઇના વાહનો વીજ લાઇનની નીચેથી સાવચેતીપૂર્વક પસાર કરવા જેથી અકસ્માત ન થાય

વીજ લાઇન ઉપર લંગર નાંખીને વીજ પ્રવાહ લેવો નહિં, આવું કાર્ય કરતી વખતે અકસ્માત થતાં હોય છે. વીજળીની લાઇનો તથા વીજ ઉપકરણો સાથે ચેડા ન કરો.



કપડામાં ઇસ્ટ્રી કરતાં પહેલા વાયર અચૂક તપાસો. ભીના હાથે સ્વિચ તેમજ ઇલેક્ટ્રીક ઉપકરણ નો ઉપયોગ ન કરવો.

વીજળીના તાર કે વાયર પાસે પતંગ ઉડાડવી નહીં કે વીજળીના થાંભલા પરથી કોઈપણ જાતના ઇન્ટરનેટ કે ટીવીના કેબલ લગાડવા નહીં જેનાથી જોખમ રહે છે.



જાહેર વિજ્ઞપ્તિ : (૧) ઇન્ડિયન ઇલેક્ટ્રીસિટી એક્ટ ૨૦૦૩ના વીજ અધિનિયમની પેટા કલમ નં ૧૩૫ મુજબ વીજચોરીએ ગુન્હો બને છે. (૨) વીજ ચોરી માટે કાયદાકીય (કાનૂની) રીતે રોકડ દંડ તથા જેલની સજાની જોગવાઈ છે. (૩) વીજચોરોને ખુલ્લા પાડો અને વિજિલન્સ વિભાગને જાણ કરો.

“વીજળીની ચોરી-જેલની સજા” ફોન નંબર : ૧૮૦૦ ૨૩૩ ૩૦૩૦

જિંદગી તો છે કિંમતી, અમાનત રાખો

અકસ્માતથી કાયમ સલામત